


અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ

સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ



માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫
કલમ નંબર ૪ (૧) અનુયે

પ્રો-એક્ટિવ ડીસ્કલોઝર

(વર્ષ : ૨૦૧૭-૧૮)

(૧) વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો :-

લાઈટ વિભાગનાં ટેકનીકલ વિભાગ તથા વહીવટી વિભાગ દ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

સ્ટ્રીટલાઈટ પ્રોજેક્ટ મારફત અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન સંચાલીત વિસ્તારમાં હ્યાત સ્ટ્રીટલાઈટના ઓપરેશન અને મેઇન્ટેનાન્સ ઉપરાંત સક્ષમ સત્તાની મંજુરી મુજબ નવા સ્ટ્રીટલાઈટ સુવિધા ઉપલબ્ધ કરાવવાની કામગીરી ઉપરાંત હાઈમાસ્ટ લાઈટ સુવિધા ઇન્સ્ટોલેશન, ઓપરેશન અને મેઇન્ટેનાન્સની કામગીરી કરવામાં આવે છે.

લાઈટ વિભાગનાં એનજી એફિશીયન્સી સેલ દ્વારા અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન ના એનજી કન્જીવિશન બાબતની કામગીરી કરવામાં આવે છે.


લાઈટ વિભાગ દ્વારા અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઓફિસ બીલીંગ, હોસ્પિટલ, સ્મશાનગૃહ, સ્વીમીંગ પુલ, પબ્લિક ગાર્ડન અને સ્કુલ બીલીંગના ઇલેક્ટ્રીફિકેશન તેમજ તેના ઓપરેશન અને મેઇન્ટેનાન્સની કામગીરી કરવામાં આવે છે. લાઈટ ખાતા દ્વારા અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન હસ્તકનાં તમામ A.C., HVAC, પ્લાન્ટ્સ, લીઝ્ટસ, વોટર ફુલર્સનાં ઓપરેશન અને મેઇન્ટેનાન્સની કામગીરી કરવામાં આવે છે.

લાઈટ ખાતાનાં વહીવટી વિભાગ દ્વારા મુખ્યત્વે વર્ગ ૧ થી ૪ સુધીના અધિકારી તથા કર્મચારીઓનાં પગાર, તેઓના સર્વીસ બુક સંબંધીત તેમજ તેઓની નિવૃત્તિ, સૈ.નિવૃત્તિ, અવસાન, રીમુવ, અનફીટ થયા બાદ કર્મચારીઓને મળવાપત્ર લાભો ચુકવવાની કામગીરી જેવા વિવિધ કાર્યો તથા કાર્યલક્ષી સંબંધીત રેકૉર્ડ નીભાવણી અને તેને લગતી આનુષ્ઠાંગીક કામગીરી તથા ટેકનીકલ વિભાગ દ્વારા કરવામાં આવનાર કામોનું સક્ષમ સત્તાની મંજુરી મુજબ બજેટ બુકીં તેમજ સક્ષમ સત્તાની મંજુરી મુજબ કોન્ટ્રાક્ટરનાં બીલનાં પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે.

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	સંપર્ક નંબર
૧	શ્રી મહેન્દ્ર એચ. નિનામા	એડી. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (લાઈટ)	M - ૯૮૭૪૫૧૪૩૮૧ O - ૦૭૯૨૫૩૮૧૮૧૧
૨	શ્રી દિપક એચ. સુથાર	ડે. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ)	M - ૯૮૨૮૧૯૭૫૪૩ O - ૦૭૯૨૫૩૮૧૮૩૨
૩	શ્રી વાય. યુ. પ્રભાકર	ડે.સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રીકલ-૧)	M - ૯૮૨૭૫૫૪૮૦૨ O - ૦૭૯૨૫૩૮૧૮૧૧
૪	શ્રી એ.એ.મલ	ડે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રીકલ-૨)	M - ૯૮૭૬૦૧૭૫૬૫ O - ૦૭૯૨૫૩૮૧૮૧૧
૫	શ્રી એમ.યુ. પાવાગઢી	ડે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રીકલ-૩)	M - ૯૮૨૭૦૩૮૭૮૧ O - ૦૭૯૨૫૩૮૧૮૧૧
૬	શ્રી ઓગાંધીન મેકવાન	આસી. મેનેજર અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટ)	M - ૯૮૨૮૩૮૮૨૮૫

◎ Education in Early Twentieth-Century China

Page 2 of 2



(૨) અધિકારીઓ અને કર્મચારીઓનાં કાર્યોત્ત્થા ફરજો :

ક્રમ	જગ્યાનું નામ	અધિકારી/કર્મચારી પાસેથી લેવામાં આવતી કામગીરી
૧	એડી. ચીફ એન્જિનીયર	અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઓફિસના મકાન બિલીંગ, હોસ્પિટલો વિગેરેની તમામ જગ્યાઓએ આવેલ ઈલે. મીડે.ને લગતી મેઈન્ટનન્સની કામગીરી તથા ટેન્ડરની કામગીરી
૨	ડે. ચીફ એન્જિનીયર	એસઆરએફડીસીએલ તેમજ અન્ય પ્રોજેક્ટ, સ્ટ્રીટલાઇટ તથા નવા પ્રોજેક્ટની કામગીરી
૩	ડે. સીટી ઈજનેર	<p>દરેક વિભાગની વિઝિટ કરવી.</p> <p>ઓ એન્ડ એમ નો કોન્ટ્રાક્ટરમાં ટેન્ડર મુજબ મુજબ સ્ટાફ તથા કામગીરી થાય તે મુજબ ધ્યાન રાખવું.</p> <p>ઓમેન્ટેશન કરવાની જરૂરીયાત છે કે કેમ તેની ટેકનીકલ ચકાસણી કરી યોગ્ય વહીવટી કામગીરી કરવી.</p> <p>કેપીટલ કામ તથા રેવન્યુ કામના ટેન્ડર સમયસર કરવા.</p> <p>એકસ્ટ્રા આઈટમ થતી હોઈ તો તેની ચકાસણી, અન્ય વિકલ્પ, સક્ષમ સત્તાની મંજુરીની કામગીરી.</p> <p>એનજી એફીશીયન્સીને લગતી કામગીરી.</p> <p>પાવર ફેક્ટર ઈમ્પ્રોવેન્ટ</p> <p>સ્ટાફની વ્યવસ્થા.</p> <p>બજેટને લગતી કામગીરી.</p> <p>પ્રોજેક્ટનું મોનીટરીંગ સમયસર પૂર્ણ થાય તે અંગે કામગીરી, કવોલીટી તથા મેજરમેન્ટની ચકાસણી.</p> <p>ઈલે. મીડે. સ્પેર્સ, સબ પંપની વધારાની સ્પેર વ્યવસ્થા રાખવી.</p> <p>હસ્તક હેઠળના સ્ટાફની કામગીરી પર દેખરેખ અને પરફોર્મન્સ ઈવેલ્યુઅશન આરટીઆઈ, એમપી-એમએલએ ના ગ્રશ્નના સમયસર જવાબ કરવા</p> <p>વિભાગની વહીવટી કામગીરી</p>
૪	આસી.સીટી ઈજનેર	<p>અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઈલે.મીડે. ઈક્વિપમેન્ટ બંધના રહે તેનું ધ્યાન રાખવું તથા ઈલે. મીડે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીંગ કરાવવું.</p> <p>કલોરીનેશન પ્લાન્ટ (વકીગ/સ્પેર) ચાલુ કરીશનમાં રાખવા તથા કલોરીનેશનયુક્ત પાણી જ સપ્લાય થાય તે સુનિશ્ચિત કરવું.</p> <p>ખુનિસિપલ સ્નાનાગારમાં પાણીની શુદ્ધતા અંગે ધ્યાન રાખવું.</p> <p>પ્રીવેન્ટીલ મેઈન્ટનન્સ સમયસર થાય તેનું પ્લાનીંગ કરવું.</p> <p>ઓ એન્ડ એમ કોન્ટ્રાક્ટર રીપેરીંગના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહીં તેનું ચેકીંગ કરવું.</p> <p>પ્રોજેક્ટના કામના ઓમેન્ટેશનના કેપીટલ કામોના, રેવન્યુ કામોના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર સ્પેસીઝીકેશન મુજબ કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું, પાવર પ્રોક્યોરમેન્ટની સમયબદ્ધ કામગીરી કરવી.</p> <p>કેપીટલ તેમજ રેવન્યુ કામોની એમ.બી. રેકોડીંગ, મેજરમેન્ટ તથા કવોલીટી ચકાસણીની કામગીરી.,,</p> <p>પાવર ફેક્ટર ઈમ્પ્રોવેન્ટની કામગીરી.</p> <p>એનજીબીલનું દર માસે સ્કુટીની કરવું તથા એનજી વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકીદે પગલાં લેવાં.</p> <p>ઝોનલ એક્ટીવીટી, હાલ્સ, લીફ્ટ્સ, એ.સી. ફંક્શનસ, એએમ્સી મેટ, સોલર, ઈવેન્ટ્સ સ્પેશીયલ, એસઆરએફડીસીએલ તથા વરસાદની ગુતુમાં અન્ડરપાસમાં પાણી ભરાય તો તે માટે નિકાલની કામગીરી સેન્ટ્રા મારફતે કરાવવી.</p>

૫	આસી. ઈજનેર	કોઈપણ ઈલે.-મીકે. ઈક્વીપમેન્ટ બંધના રહે તેનું ધ્યાન રાખવું. ઇલે.મીકે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીગ કરાવવું. પ્રીવેન્ટીવ મેઈન્ટેનન્સ સમયસર થાય તેનું ખાનીગ કરવું. કોન્ટ્રાક્ટ ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહી તેનું ચેકીગ કરવું. ટેન્ડરમાં કેપીટલ/રિવન્યુ કામના એમ.બી. રેકોડીગ કરવું તેમજ મેઝરમેન્ટ ચેક કરવું. પ્રોજેક્ટ/ઓગમેન્ટેશનના કામમાં ઈરેક્શન સમયે ટેકનીકલ ચકાસણી કરવી. સ્ટાફ સંબંધી વહીવટી કામગીરી કરવી. એનજી એફિશીયન્સીને લગતી કામગીરી. એનજી બીલનું દર માસે સ્કુટીની કરવું તથા એનજી વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકીદ પગલાં લેવાં જોનલ એક્ટીવીટી, ડાલ્સ, લીફ્ટ્સ, એ.સી. ફંક્શનસ, એએમ્સી મેટ, સોલર, ઈવેન્ટ્સ સ્પેશીયલ, એસઆરએફડીસીએલની કામગીરી
૬	ટેક.સુપરવાઈઝર	લેખીત રીપોર્ટ એ.ઇ./એ.સી.ઇ.ને દરરોજ આપવા, ડાયરી મેઈન્ટેઇન કરવી, કોઈપણ પ્રોબ્લેમ હોય તો એ.ઇ./એ.સી.ઇ. અથવા એ.સી.ઇ.ને જાણ કરવી.
૭	સ્ટ્રીટલાઈટ ઈસ્પે.	સ્ટ્રીટલાઈટ બંધ ન રહે તેનું ધ્યાન રાખવું તથા સમયસર જરૂરીયાત મુજબની કામગીરી કરાવવી.
૮	લીફ્ટમેન	સમયસર લીફ્ટ ચલાવવાની કામગીરી.
૯	ઇલેક્ટ્રીશયન	ઓવરઓલ એસઆરએફડીસીઅલ, પ્રોજેક્ટ મોસ્ટ ઓફ આઈઅમ્પી પ્લેસીસ, મઈન્ટેન્સ ઓફિસ બીલીયસુની કામગીરી
૧૦	ટેલી. ઓપરેટર	બહારથી આવતા તથા આંતરીક ખાતાકીય તમામ ફોન સંબંધીત અધિકારીશ્રી સુધી સંપર્ક કરી આપવા તથા તેને આનુસંગીક રજીસ્ટરો બનાવવા તથા નિયમીત અપડેટ કરવા
૧૧	રીસે.કમ ટેલી.ઓપરેટર	બહારથી આવતા તથા આંતરીક ખાતાકીય તમામ ફોન સંબંધીત અધિકારીશ્રી સુધી સંપર્ક કરી આપવા તથા તેને આનુસંગીક રજીસ્ટરો બનાવવા તથા નિયમીત અપડેટ કરવા
૧૨	આસી. મેનેજર	જુદા જુદા ખાતાઓની વહેચણી કરેલ હોઈ લાઈટ(સ્ટ્રીટલાઈટ) તથા પ્રોજેક્ટને લગતાં વિષયોની કામગીરી, ઇભ્રેશ કેશ, પાર્ટી પેમેન્ટની તમામ કામગીરી, ઇએમ્સી, પેમેન્ટ પહોંચ, સ્ટ્રીટલાઈટના બીલોને લગતી તમામ કામગીરી
૧૩	ઓફિસ સુપ્રીન્ટેન્ન્ટ	આસી.મેનેજરશ્રીની સુચના અનુસાર તમામ કામગીરી
૧૪	એકાઉન્ટન્ટ	ખાતાની નાણાંકીય તમામ કામગીરીનું સંચાલન
૧૫	છેડ કલાર્ક	ઓફિસ સુપ્રી.ની સુચના અનુસાર વહીવટી કામગીરી
૧૬	સીની. કલાર્ક	જુદા જુદા ખાતાઓની વહેચણી કરેલ હોઈ લાઈટ(સ્ટ્રીટલાઈટ) તથા પ્રોજેક્ટને લગતાં વિષયોની કામગીરી, ઇભ્રેશ કેશ, પાર્ટી પેમેન્ટની તમામ કામગીરી, ઇએમ્સી, પેમેન્ટ પહોંચ, સ્ટ્રીટલાઈટના બીલોને લગતી તમામ કામગીરી
૧૭	જુની.કલાર્ક	બજેટ બુક, ઠરાવ, બીલ કલાર્ક, રીએભ્સમેન્ટ, સર્વિસ બુક મેઈન્ટેનન્સ, કર્મચારી/અધિકારી નિવૃત્તિ તથા સ્વ.નિવૃત્તિની કામગીરી, પોસ્ટેજ, આઈટવર્ક-ઇનવર્ક ની કામગીરી.
૧૮	પટાવાળા	ઇનડોર પટાવાળા - ખાતાકીય પટાવાળા તરીકેની કામગીરી આઉટડોર પટાવાળા - બહારના ખાતાને લગતી ટપાલો આપવા જવાની કામગીરી, તથા ખાતાકીય પત્રો પોસ્ટેજની કામગીરી
૧૯	સ્ટોર કિપર	સ્ટોરને આનુષાંગિક તમામ કામગીરી
૨૦	સ્ટોર સુપરવાઈઝર	સ્ટોરને આનુષાંગિક તમામ કામગીરી
૨૧	ટાઈપીસ્ટ કમ કલાર્ક	ખાતાકીય પત્રોની ટાઈપીગની કામગીરી
૨૨	સ્ટેનોગ્રાફર	અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ખાતાકીય પત્રોને લગતી તમામ કામગીરી

૨૩	સીની. ચાર્જમેન	ગાર્ડન, ઇલેક્ટ્રીક સર્વિસ, સોલર પ્રોજેક્ટને લગતી કામગીરી.
૨૪	જુની. ચાર્જમેન	મશીનરીની મિકેનીકલ ઇક્વીપમેન્ટને પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી કરાવવી તથા મિકેનીકલ ગેંગ સાથે તેમજ ફીટર, ટર્નર, ગેંગમજુર વિગેરેને મિકેનીકલ માર્ગદર્શન કરી તેઓ સાથે કો-ઓર્ડિનેશન કરી કામગીરી કરાવવી.
૨૫	મીટર ઇસ્પેક્ટર	મીટરને લગતી તમામ કામગીરી
૨૬	રેઝિઝરેશન મીકેનીક	રેઝિઝરેશનને લગતી તમામ મીકેનીકલની તથા સર્વિસ કરાવવાની કામગીરી
૨૭	સીની. રેઝિ.ફીટર	તમામ એરક્ષિશન, વોટરકુલર તથા ફીજને લગતી તમામ મેઈન્ટેનન્સ તથા સર્વિસને લગતી કામગીરી
૨૮	સુપ. કમ વર્કમેન	ઇલે. મીકે. સ્ટોર સંભાળવાની કામગીરી
૨૯	પીકઅપવાન ડ્રાઇવર	ખાતાની કામગીરી માટે હેવી, મિડીયમ હેવી, લાઈટ વ્હીકલને ખાતાના સ્ટાફ સાથે કામગીરી કરવા વાહનો ચલાવવાની કામગીરી તથા વાહનોને મેઈન્ટેઇન કરવાની જવાબદારી
૩૦	ડ્રાઇવર	ખાતાની કામગીરી માટે હેવી, મિડીયમ હેવી, લાઈટ વ્હીકલને ખાતાના સ્ટાફ સાથે કામગીરી કરવા વાહનો ચલાવવાની કામગીરી તથા વાહનોને મેઈન્ટેઇન કરવાની જવાબદારી
૩૧	રીક્ષા ડ્રાઇવર	ખાતાની કામગીરી માટે ખાતાના સ્ટાફ સાથે કામગીરી કરવા રીક્ષા ચલાવવાની કામગીરી તથા રીક્ષા મેઈન્ટેઇન કરવાની જવાબદારી
૩૨	પંપ અને વાયરમેન એટેન્ટ	પંપને લગતી કામગીરી.
૩૩	વાયરમેન	ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટ તેમજ સંસ્થાના અન્ય વિભાગો વિગેરે રૂમોની લાઈટીંગ તથા જરૂરી વાયરીંગ કરવાની કામગીરી તથા ઇલેક્ટ્રીશિયનની સાથે ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી કરવી.
૩૪	મીકેનીક	રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી કરવાની તથા મિકેનીકલ ગેંગની કામગીરીની વહેંચાણી તેમજ સીની. ચાર્જમેન, જુની ચાર્જમેન, ફીટર, ટર્નર, ગેંગ મજુર વિગેરેને ટેકનીકલ મિકેનીકલ માર્ગદર્શન કરી તેઓ સાથે કો-ઓર્ડિનેશન કરી કામગીરી કરાવવી.
૩૫	જુની. રેફરી. ફીટર	એરક્ષિશન, વોટરકુલર અને ફીજને લગતી તમામ મીકે. તથા મેઈન્ટેનન્સ સર્વિસને લગતી કામગીરી.
૩૬	ફીટર	સેન્ટ્રીફ્યુગલ પંપ મોટર સેટ તથા મિકેનીકલ મશીનરીનાં પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગ કરવાની કામગીરી તેમજ આસી.ફીટરને મિકેનીકલ માર્ગદર્શન કરી કામગીરી કરાવવી.
૩૭	પંપમેન	પંપિંગ સ્ટેશનમાં આવેલ પંપો ચાલુ બંધ કરવાની કામગીરી
૩૮	નાયક	ઇલે. મીકેનીકની કામગીરીની દેખરેખ રાખવાની કામગીરી
૩૯	આસી. મીકેનીક	પંપના મીકે. ને લગતી કામગીરી
૪૦	વાયરમેન હેલ્પર	ઇલેક્ટ્રીશિયન અને/અથવા વાયરમેન સાથે સંસ્થાના અન્ય વિભાગની તમામ ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટનાં ઓપરેશનની કામગીરી તેઓની સાથે રહી કરવી.
૪૧	ફીટર હેલ્પર	મીકે. કામમાં ફીટરને જરૂરી હેલ્પ કરવાની કામગીરી
૪૨	ગેંગ મજુર	તમામ ખાતાની ઇલેક્ટ્રીકલ, મિકેનીકલ મશીનરી તથા કલોરીન મશીનરીની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગ કામગીરી કરવાની ગેંગની સાથે રહી સુચના મુજબની મજુરીની કામગીરી.
૪૩	કલોરીન સુપરવાઈઝર	કલોરીન યુનિટની જાળવણી તથા મેઈન્ટેનન્સ સર્વિસને લગતી કામગીરી

- (૩) દેખરેખ અને જવાબદારનાં માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસારની માહિતી :
ખાતાની કામગીરીનાં અનુસંધાને જે તે સક્ષમ સત્તાની મંજુરી મેળવીને નિર્ણય લેવામાં આવે છે.
- (૪) પોતાનાં કાર્યો બજાવવા માટે નક્કી કરેલાં ધોરણો :
જે તે કામગીરી માટે સક્ષમ સત્તાની જરૂરી મંજુરી મુજબ તુમાર અને ફાઈલોનો નિકાલ કરવામાં આવે છે.
- (૫) પોતાનાં કાર્યો બજાવવા માટે પોતાની પાસેનાં અથવા પોતાનાં નિયંત્રણ હેઠળનાં અથવા પોતાનાં કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ :
અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશનનાં નીતિ-નિયમો તથા બોઝે પ્રોવિન્સીયલ ભૂનિસિપલ એક્ટ-૧૯૪૮ ની જોગવાઈઓ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.
- (૬) પોતાની પાસે અથવા પોતાનાં નિયંત્રણ હેઠળ હોય તેવાં દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક :
લાઈટ ખાતાનાં વર્ગ-૩ અને વર્ગ-૪ માં જુદા જુદા હોક્સ હેઠળનાં કેટેગરી વાઈજ કર્મચારીઓ/અધિકારીઓની સર્વિસબુક, પગારનાં પત્રકો તથા તેને લગતાં આનુષાંગિક રેકર્ડ નિભાવવામાં આવે છે.
- (૭) તેની નિતી અથવા તેનાં અમલીકરણનાં ઘડતર સંબંધમાં જનતાનાં સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિધમાન ગોઠવણીની વિગતો :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૮) તેનાં ભાગ તરીકે અથવા તેની સલાહમાં હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓનાં બનેલાં બોર્ડ કાઉન્સીલો, સમિતિઓ અને બીજાં મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેની બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૯) તેનાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :
અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશન મારફતે દર વર્ષે બહાર પાડવામાં આવતી ડાયરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત સદર ડાયરીની સોફ્ટકોપી અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશનની વેબસાઈટ www.ahmedabadcity.org પર મુકવામાં આવે છે. જેમાં દર વર્ષે અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશન દ્વારા બહાર પાડવામાં આવતી ડાયરીમાં અગત્યનાં ટેલીફોન નંબરોનો સમાવેશ કરવામાં આવે છે.

(૧૦) તેનાં વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેનાં દરેક અધિકારીઓ અને મળતાં માસિક વળતર :

ક્રમ	હોદ્દો	પે મેટ્રીક્સ
૧	ચીફ એન્જનીયર	૧૧૮૫૦૦-૨૧૪૧૦૦
૨	એડી. સી.ઇ.	૧૧૮૫૦૦-૨૧૪૧૦૦
૩	ટી.સી.ઇ.	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૪	આ.સી.ઇ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૫	આસી.ઇજનેર	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૬	ટેક.સુપરવાઈઝર	૨૮૨૦૦-૮૨૩૦૦
૭	સ્ટ્રીટલાઈટ ઇસ્પે.	૨૫૫૦૦-૮૧૧૦૦
૮	લીફ્ટમેન	૧૮૬૦૦-૬૩૨૦૦
૯	ઇલેક્ટ્રીશયન	૨૫૫૦૦-૮૧૧૦૦
૧૦	ટેલી. ઓપરેટર	૨૫૫૦૦-૮૧૧૦૦
૧૧	રીસે.ક્મ ટેલી.ઓપરેટર	૧૮૬૦૦-૬૩૨૦૦
૧૨	આસી. મેનેજર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૧૩	ઓફિસ સુપ્રીટેન્નાન્ટ	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૧૪	એકાઉન્ટન્ટ	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૫	હેડ કલાર્ક	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૬	સીની. કલાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦
૧૭	જુની. કલાર્ક	૧૮૬૦૦-૬૩૨૦૦
૧૮	પટાવાળા	૧૪૮૦૦-૪૭૧૦૦
૧૯	સ્ટોર કિપર	૨૮૨૦૦-૮૨૩૦૦
૨૦	સ્ટોર સુપરવાઈઝર	૧૮૬૦૦-૬૩૨૦૦
૨૧	ટાઈપીસ્ટ ક્મ કલાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦
૨૨	સ્ટેનોગ્રાફર	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૨૩	સીની. ચાર્જમેન	૨૮૨૦૦-૮૨૩૦૦
૨૪	જુની. ચાર્જમેન	૨૫૫૦૦-૮૧૧૦૦
૨૫	મીટર ઇસ્પેક્ટર	૨૫૫૦૦-૮૧૧૦૦
૨૬	રેફીજરેશન મીકેનીક	૨૫૫૦૦-૮૧૧૦૦
૨૭	સીની. રેફી.ફીટર	૨૫૫૦૦-૮૧૧૦૦
૨૮	સુપ. ક્મ વર્કમેન	૧૮૬૦૦-૬૩૨૦૦
૨૯	પીકઅપવાન ડ્રાઈવર	૧૮૬૦૦-૬૩૨૦૦
૩૦	ડ્રાઈવર	૧૮૬૦૦-૬૩૨૦૦
૩૧	રીક્ષા ડ્રાઈવર	૧૮૬૦૦-૬૩૨૦૦
૩૨	પંપ અને વાયરમેન એટેન્ટ	૧૮૬૦૦-૬૩૨૦૦
૩૩	વાયરમેન	૧૮૬૦૦-૬૩૨૦૦
૩૪	મીકેનીક	૧૮૬૦૦-૬૩૨૦૦
૩૫	જુની. રેફી. ફીટર	૧૮૬૦૦-૬૩૨૦૦
૩૬	ફીટર	૧૮૬૦૦-૬૩૨૦૦
૩૭	પંપમેન	૧૪૭૦૦-૫૦૦૦૦
૩૮	નાયક	૧૪૭૦૦-૫૦૦૦૦
૩૯	આસી. મીકેનીક	૧૪૭૦૦-૫૦૦૦૦
૪૦	વાયરમેન હેલ્પર	૧૪૭૦૦-૫૦૦૦૦
૪૧	ફીટર હેલ્પર	૧૪૭૦૦-૫૦૦૦૦
૪૨	ગેગ મજૂર	૧૪૮૦૦-૪૭૧૦૦
૪૩	કલોરીન સુપરવાઈઝર	૧૮૬૦૦-૬૩૨૦૦

(૧૧) તમામ યોજનાઓ સૂચિત ખર્ચ અને કરેલી વહેચણી પરનાં અહેવાલોની વિગતો દર્શાવતું અંદાજપત્ર :
 સદર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
www.ahmedabadcity.org અને વર્ષ ૨૦૧૭-૧૮ નાં અંદાજપત્રમાં મુકવામાં આવેલ છે.

(૧૨) ફાળવેલ રકમ અને એવા કાર્યક્રમોનાં લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૩) આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :
 આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૪) ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો :

સદર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
www.ahmedabadcity.org અતેના ખાતાને લગતી માહિતી, અગત્યનાં ટેલીફોન નંબરો તથા વર્ષ ૨૦૧૭-૧૮ નાં અંદાજપત્ર તથા બીજી અગત્યની માહિતી ઉપલબ્ધ છે.

(૧૫) જાહેર ઉપયોગ માટે નિભાવવમાં આવતાં હોય તેવા ગ્રંથપાલ અથવા તેનાં વાંચનાલયનાં કામકાજનાં કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :
 આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૬) જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદાઓ અને બીજી વિગતો :

ક્રમ	અધિકારીનું નામ અને હોદ્દો	કર્ઝનો સમય	કર્ઝનું સ્થળ	સંપર્ક નંબર
૧	શ્રી મહેન્દ્ર એચ. નિનામા એડી. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (લાઈટ)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૭૪૫૧૪૩૮૧ O -૦૭૮૨૫૩૯૮૧૧
૨	શ્રી હિપક એચ. સુથાર ટે. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (સ્ટ્રીટલાઇટ/પ્રોજેક્ટ)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૮૨૮૧૯૭૫૪૩ O -૦૭૮૨૫૩૯૧૮૩૨
૩	શ્રી વાય. યુ. પ્રભાકર ટે.સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઈલેક-૧)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૮૨૭૫૫૪૮૦૨ O -૦૭૮૨૫૩૯૮૧૧
૪	શ્રી એ.એ.મલ ટે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઈલેક-૨)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૩૭૬૦૧૭૫૬૫ O -૦૭૮૨૫૩૯૮૧૧
૫	શ્રી એમ.યુ. પાવાગઢી ટે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઈલેક-૩)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૮૨૭૦૩૮૭૮૧ O -૦૭૮૨૫૩૯૮૧૧
૬	શ્રી ઓગણીન મેકવાન આસી. મેનેજર અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટી બાબત)	સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી	“બી”-બ્લોક, ચોથો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ	M -૯૮૨૮૩૮૮૨૮૫

(૧૭) ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :
 નથી.

એનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગનાં તા. ૧-૫-૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક-પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૪૬૪-આરટીઆઈસેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણ પત્ર આપવામાં આવે છે કે લાઇટ વિભાગના જાહેર સત્તામંડળ દ્વારા માહિતી અધિકારી અધિનિયમની કલમ ૪ (૧) (ખ) અંતર્ગત સ્વચંમ જાહેર કરવાની બાબતો - પ્રોએક્ટીવ ડીસ્કલોગર (પીએડી) તૈયાર કરવામાં આવેલ છે.

જે તા. ૦૧.૦૫.૨૦૧૭ ની સ્થિતીએ અધ્યયતન કરવામાં આવેલ છે. જેનું અમારા દ્વારા ઈન્સપેક્શન કમ ઓડિટ કરવામાં આવેલ છે અને જે બાબતે અપુરૂતી વિગતો જણાએ હતી તેની પુર્તી કરાવવામાં આવેલ છે.

તા. ૦૧.૦૫.૨૦૧૭

એડી. ચીફ ઓફિસિયર
(લાઇટ)

મુખ્ય મથક - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
સરદાર પટેલ ભવન, સી-લોક, પાંચમો માળ,
દાણાપીઠ, ખમાસા રોડ, અમદાવાદ

કચેરીનું નામ -લાઇટ ખાતું

ખાતાનું નામ: લાઈટ

તા. ૧૧.૦૫.૨૦૧૭.

પ્રતિ,
જાહેર માહિતી અધિકારી અને એસેસર અને ટેક્સ કલેક્ટરશ્રી,
આર.ટી.આઈ. સેલ વિભાગ
સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ

વિષય : માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે પ્રો-ઓક્ટીવ ડીસ્કલોઝર
(વર્ષ ૨૦૧૭-૧૮) ની માહિતી બાબત....

સંદર્ભ : (૧) આર.ટી.આઈ. સરક્યુલર નંબર-૦૨, તા.૦૨.૦૫.૨૦૧૭.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને લાઈટ ખાતાની વર્ષ ૨૦૧૭-૧૮ માટે જાહેર
માહિતી અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪(૧) અન્વયેની જાહેર માહિતી તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે
સામેલ છે, તો સદરંભું માહિતીને જાહેર માહિતી અધિનિયમ હેઠળ આગળની આનુષંગિક કાર્યવાહી થઈ આવવા
રખાવી લેવા વિનંતી સહ.

ઓ.એસ. આસી.મેનેજર
(લાઈટ)

એડી. ચીફ એન્જિનીયર
(સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ)

એડી.ચીફ એન્જિનીયર
(લાઈટ)